

RAN-2408000603050006
S.Y.B.Com. (Sem. III) Examination March - 2026
SEC - Banking - I
[Total Marks: 25

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: Student's Signature
---	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (કોઈપણ પાંચ) 10**
1. બેંકર એટલે શું?
 2. ચેકમાં મહત્વના ફેરફારના ચાર ઉદાહરણ આપો.
 3. ચેકની વસુલાતનો અર્થ આપો.
 4. ખાસ લિયનનો અધિકાર એટલે શું?
 5. ચેક પર નિશાની કરવી એટલે શું?
 6. બેંકના ગ્રાહક બનવા માટેની શરતો જણાવો.
 7. યર્થાથ ચૂકવણીનો અર્થ સમજાવો.
- પ્ર.2. બેંકર ગ્રાહક વચ્ચેના સામાન્ય સંબંધોના લક્ષણોની વિસ્તૃત ચર્ચા કરો. 15**
- અથવા**
- પ્ર.2. (અ) કયા સંજોગોમાં બેંકરે નાણાં ચૂકવવાનો ઈન્કાર કરવો જ જોઈએ? 07**
- (બ) કયા સંજોગોમાં નાણાં વસુલ કરનાર બેંકરને બેદરકાર ગણી શકાય? તેની બેદરકારીનું શું પરિણામ આવી શકે? 08**

ENGLISH VERSION

- Q.1. Answer in Briefly. (Any 5) 10**
- (1) Define “banker”.
 - (2) Give four examples of material alteration in a cheque.
 - (3) Give the meaning of a collection of cheque.
 - (4) What do you mean by banker’s special lien?
 - (5) What is meant by a marking of the cheque?
 - (6) State essential conditions to become a customer of a bank.
 - (7) Explain - Payment in due-course.
- Q.2. Discuss the general characteristics of Banker - Customer relationship in details. 15**
- OR**
- Q.2. (A) Under what circumstances should a banker refuse to pay a cheque? 07**
- (B) Under what circumstances can a banker be considered negligence in accepting a cheque? What are the consequences of his negligence? 08**